

ત્વરિત જાહેરાત માટે

2022ની બ્રેમ્પટન મ્યુનિસિપલ અને સ્કૂલ બોર્ડની ચૂંટણી માટે ઉમેદવાર નામાંકનો અને તૃતીય પક્ષ જાહેરાતકર્તાની નોંધણીઓ 2 મે ના રોજથી ખુલશે

બ્રેમ્પટન, ઓન્ટારિયો (26 એપ્રિલ 2022) – 2 મે ના રોજથી 2022 નગરપાલિકાની ચૂંટણી માટે સીટી ઓફ બ્રેમ્પટન ક્લર્કની કચેરી, ઉમેદવાર નામાંકનો અને તૃતીય પક્ષ જાહેરાતકર્તા નોંધણીઓ સ્વીકારવાનો પ્રારંભ કરશે.

ઉમેદવારો માટે નામાંકન અવધિ 19 ઓગસ્ટ 2022ના રોજ બપોરે 2 વાગ્યે સમાપ્ત થાય છે.

તૃતીય પક્ષ જાહેરાતકર્તાઓની નોંધણીની અવધિ 01 ઓક્ટોબર 2022ના રોજ સમાપ્ત થશે.

ઉમેદવારો અને તૃતીય પક્ષ જાહેરાતકર્તા માટેના સામાન્ય દિશાનિર્દેશો વિષયક એક પ્રસ્તૂતિ સીટીની વેબસાઈટ પર ઉપલબ્ધ છે.

ઉમેદવારો

સીટી નીચે આપેલ હોદ્દાઓ માટે નામાંકનો સ્વીકારશે:

- નગરપતિ (મેયર)
- પ્રાદેશિક પરિષદ સભ્ય (રીજનલ કાઉન્સિલર)
- શહેર પરિષદ સભ્ય (સીટી કાઉન્સિલર)
- નીચે આપેલ મંડળો માટે શાળા મંડળ ટ્રસ્ટી (સ્કૂલ બોર્ડ ટ્રસ્ટી):
 - પીલ ડિસ્ટ્રિક્ટ સ્કૂલ બોર્ડ
 - ડફ્રિન-પીલ કેથોલિક ડિસ્ટ્રિક્ટ સ્કૂલ બોર્ડ
 - કૉસેઈ સ્કૉલે કેથોલિક મોએવોનિર (Conseil scolaire catholique MonAvenir)

સિટી ઓફ મિસિસોગા સ્કૂલ બોર્ડ ટ્રસ્ટી, કૌંસેઈ સ્કૉલે વાએમોન્ડ માટેના ઉમેદવાર નામાંકનો સ્વીકારશે.

ઉમેદવારો માટેના નોમિનેશન ફોર્મ્સ એટલેકે નામાંકન પત્રો અને માહિતી પેકેજ બ્રમ્પટન સીટી હોલ ખાતે સ્થિત સીટી ક્લર્કની કચેરી પર અને ઓનલાઈન ઉપલબ્ધ છે. ફોર્મ પોતે (અથવા એજન્ટ દ્વારા) કચેરીના નિયમિત સમય દરમિયાન સવારે 8:30 થી સાંજે 4:30 વાગ્યા વચ્ચે અઠવાડિયાના દિવસોમાં મે 1થી શરૂ કરી 19 ઓગસ્ટ 2022ના રોજ બપોરે 2 સુધી ફાઈલ કરી શકાશે. નોમિનેશન (નામાંકન) ફોર્મ ભરવા માટે એપોઈન્ટમેન્ટ જરૂરી છે. જરૂરી ફોર્મ, માહિતી પેકેજ એક્સેસ કરવા અને ફાઈલ કરવા માટેની એપોઈન્ટમેન્ટ બુક કરવા માટે www.brampton.ca/BramptonVotes ની મુલાકાત લેવા વિનંતી છે.

ફાઈલ કરતી વખતે ફી (\$200.00 મેયર માટે અને અન્ય તમામ હોદ્દાઓ માટે \$100.00) રોકડા, પ્રમાણિત ચેક અથવા મની ઓર્ડર દ્વારા ચૂકવવાપાત્ર છે. અરજદારોએ નામ અને માન્ય સરનામાના પુરાવા પૂરા પાડવાના રહેશે. ફક્ત મૂળ દસ્તાવેજો સ્વીકારાશે; ફેક્સ અથવા અન્ય ઇલેક્ટ્રોનિક સંસ્કરણોને મંજૂરી નથી. તમામ સંભવિત ઉમેદવારોએ તેમના નામાંકન પત્ર અને નામાંકનને સમર્થનનું પત્રક (એન્ડોર્સમેન્ટ ઓફ નોમિનેશન ફોર્મ) ઝુંબેશના કોઈ પણ ફાળા પ્રાપ્ત કરતા પહેલા અથવા ચુંટણી હેતુઓસર કોઈ પણ ભંડોળ ખર્ચતા પહેલા ફાઈલ કરી દેવાનું રહેશે. સ્કૂલ બોર્ડના ટ્રસ્ટી માટેના ઉમેદવારોએ એન્ડોર્સમેન્ટ ઓફ નોમિનેશન ફોર્મ ફાઈલ કરવું આવશ્યક નથી.

તૃતીય પક્ષ જાહેરાતકર્તા

કોઈપણ વ્યક્તિ, કોર્પોરેશન કે ટ્રેડ યુનિયન જેઓ પ્રસારણ, પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અથવા અન્ય માધ્યમમાં કોઈ ઉમેદવારને પ્રોત્સાહિત કરવા, ટેકો આપવા અથવા વિરોધ કરવા માટે જાહેરાત કરવા ઇચ્છતા હોય તેઓએ સીટીમાં નોંધણી કરાવવી આવશ્યક છે.

રજિસ્ટ્રેશન ફોર્મ અને માહિતી પેકેજો ઓનલાઈન તેમજ બ્રમ્પટન સીટી હોલ ખાતેની સીટી ક્લર્કની કચેરી પર ઉપલબ્ધ છે. નોંધણી જાતે (અથવા એજન્ટ દ્વારા) કાર્યાલયના કામકાજના સમય દરમિયાન અઠવાડિયાના દિવસોમાં મે 1થી શરૂ કરી 19મી ઓક્ટોબર 2018 સુધી ફાઈલ કરવાના રહેશે. નોંધણીના કાગળીયા ફાઈલ કરવા માટે એપોઈન્ટમેન્ટ જરૂરી છે. જરૂરી ફોર્મ, માહિતી પેકેજ એક્સેસ કરવા અને ફાઈલ કરવા માટેની એપોઈન્ટમેન્ટ બુક કરવા માટે www.brampton.ca/BramptonVotes ની મુલાકાત લેવા વિનંતી છે.

નોંધણી ફાઈલ કરતી વ્યક્તિએ ફાઈલિંગ કરતી વખતે મૂળ ઓળખપત્ર રજૂ કરવો અવાશ્યક છે. કોર્પોરેશન અથવા ટ્રેડ યુનિયન તૃતીય પક્ષ જાહેરાતકર્તા વતી નોંધણી કરવા ઇચ્છતા પ્રતિનિધિએ કોર્પોરેશન અથવા ટ્રેડ યુનિયનના સત્તાવાર અધિકારીની અધિકૃતિનો પત્ર પૂરો પાડવાનો રહેશે. ફક્ત મૂળ દસ્તાવેજો સ્વીકારાશે; ફેક્સ અથવા અન્ય ઇલેક્ટ્રોનિક સંસ્કરણોને મંજૂરી નથી. તૃતીય પક્ષ જાહેરાતકર્તાઓએ તેમના નોંધણીના દસ્તાવેજો ઝુંબેશના કોઈ પણ ફાળા પ્રાપ્ત કરતા પહેલા અથવા ચુંટણી હેતુઓસર કોઈ પણ ભંડોળ ખર્ચતા પહેલા ફાઈલ કરી દેવાના રહેશે.

નામાંકન થયેલ ઉમેદવારો અને નોંધણી થયેલ તૃતીય પક્ષ જાહેરાતકર્તાઓની યાદી નિયમિતરૂપે અદ્યતન થતી રહેશે અને તે www.brampton.ca/BramptonVotes પર ઉપલબ્ધ થતી રહેશે.

સુવાક્ય

“સિટી ક્લાર્કની ઓફિસ તમામ સંભવિત ઉમેદવારો અને તૃતીય પક્ષ જાહેરાતકર્તાઓને 2022ના બ્રેમ્પટન નગરપાલિકા અને સ્કૂલ બોર્ડની ચૂંટણી ઝુંબેશ દરમિયાન કાયદા અને તેમની પાસેથી શું અપેક્ષા રાખવામાં આવે છે તેનાથી પોતાને સુપરિચિત કરવા પ્રોત્સાહિત કરે છે. વધુ માહિતી માટે brampton.ca/BramptonVotes ની મુલાકાત લો અથવા 311 અથવા bramptonvotes@brampton.ca નો સંપર્ક તમને હોય એવા કોઈપણ પ્રશ્નો માટે કરો.”

- પીટર ફ્રે, સીટી ક્લાર્ક એન્ડ રિટર્નિંગ ઓફિસર, સિટી ઓફ બ્રેમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 7,00,000 લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](https://twitter.com/brampton), [Facebook](https://facebook.com/brampton), અને [Instagram](https://instagram.com/brampton) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca

મિડિયા સંપર્ક (MEDIA CONTACT):

સીટી ઓફ બ્રેમ્પટન મલ્ટિકલ્ચરલ મિડિયા

multiculturalmedia@brampton.ca